



વિજલન્સ ખાતુ  
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

માહિતી મેળવવાના અધિકાર અધિનિયમ - ૨૦૦૫

માહિતી પુસ્તીકા

( સને. ૨૦૧૫-૧૬ )

અધતન કર્યા તારીખ : ૦૧.૦૨.૨૦૧૬ની સ્થિતિએ

વિજલન્સ ખાતુ  
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન,  
૧, લો માળ, “સી” બ્લોક, સરદાર પટેલ ભવન,  
દાણાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૦૧  
ટે.નં. ૨૪૩૫૦૩૩૮, ૨૪૩૮૯૮૯૯.

## અનુક્રમણિકા

પ્રકરણ	વિષય	પાના નંબર
	પ્રસ્તાવના	
૧.	વ્યવસ્થા તંત્ર, કાર્યો અને ફરજોની વિગતો.	૪-૭
૨.	અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો	૮-૧૧
૩.	દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહીત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતી.	૧૨
૪.	પોતાના કાર્યો બજાવવા માટે પોતે નક્કી કરેલા ધોરણો.	૧૨
૫.	પોતાના કાર્યો બજાવવા માટે પોતાની પાસેના અથવા પોતાના નિયંત્રણ હેઠળના અથવા પોતાના કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા નિયમો, વિનિયમો, સુચનાઓ, નિયમ સંગ્રહો અને રેકર્ડ.	૧૨
૬.	પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક.	૧૨
૭.	તેની નિતિ અથવા તેના અમલીકરણના ઘડતરના સબંધમાં જનતાના સત્યો સાથે વિચાર વિનિમય માટે અથવા તેમના નામ દ્વારા રજુઆત માટેની વિધમાન કોઈ ગોઠવણની વિગતો.	૧૩
૮.	તેના ભાગ તરીકે અથવા તેની સલાહના હેતુ માટે બે અથવા તેથી વધુ વ્યક્તિઓના બનેલા બોર્ડ, કાઉન્સીલો, સમિતિઓ અને બીજા મંડળોની બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ ? અથવા તેવી બેઠકોની કાર્ય નોંધ લોકોને મળવા પાત્ર છે કે કેમ ?	૧૩
૯.	તેના અધિકારીઓ અને કર્મચારીઓની માહીતી પુસ્તીકા.	૧૩
૧૦.	તેના વિનિયમોમાં જોગવાઈ કર્યા પ્રમાણે વળતરની પદ્ધતિ સહીત તેના દરેક અધિકારીઓ અને કર્મચારીઓને મળતા માસિક વળતર.	૧૪
૧૧.	તમામ યોજનાઓ, સુચિત ખર્ચ અને કરેલ વહેચણી પરના અહેવાલોની વિગતો દર્શાવતું તેની દરેક એજન્સીઓ ફાળવેલ અંદાજ પત્ર.	૧૪
૧૨.	ફાળવેલ રકમો, અને એવા કાર્યક્રમોના લાભાર્થીઓની વિગતો સહીત આર્થિક સહાય કાર્યક્રમોની અમલ બજવણીની રીત.	૧૫
૧૩.	તેણે આપેલ છૂટ છાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારની વિગતો.	૧૫
૧૪.	ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં તેને ઉપલબ્ધ અથવા તેણે ધરાવેલ માહીતીને લગતી વિગતો.	૧૫
૧૫.	જાહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતા હોય તો તેવા ગ્રંથાલય અથવા તેના વાંચનાલયના કામકાજના કલાકો સહીતની માહીતી મેળવવા માટે નાગરીકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો.	૧૫
૧૬.	જાહેર માહીતી અધિકારીઓના નામો, હોદ્દાઓ અને બીજી વિગતો.	૧૬-૧૭
૧૭.	ઠરાવવામાં આવે તેવી બીજી માહીતી.	૧૭

## પ્રસ્તાવના :-

માહિતી અધિકાર અધિનિયમ -૨૦૦૫ અંતર્ગત અમદાવાદ ખુનિ.કોપોરિશનના વિજ્ઞલન્સ ખાતાને જહેર સંગઠન તરીકે જહેર કરવામાં આવેલ છે. વિજ્ઞલન્સ ખાતાની કામગીરી, અમદાવાદ ખુનિ.કોપોરિશન ના વહીવટતંત્ર માં તેનું સ્થાન, ફરજો અને જવાબદારીઓ અંગે જહેર જનતાને સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત થાય તેમજ વિજ્ઞલન્સ ખાતાના કાર્યક્ષેત્ર અંગે સામાન્ય પ્રજામાં સાચી સમજ પ્રવર્તે તથા કઈ પ્રકારની રજૂઆત કરી શકાય તે અંગેની વ્યાપક માહિતી ઉપલબ્ધ થાય તેમજ વિજ્ઞલન્સ ખાતાના કાર્યક્ષેત્રની કામગીરી વધુ સરળ, વ્યાપક તેમજ લોકાભિમુખ બને તે હેતુસર આ પુસ્તીકા અમદાવાદ ખુનિ.કોપોરિશન સાથે જેમને રોજ-બરોજની કામગીરી રહેતી હોય તેવા તમામ નાગરીકો ને તેઓની કામગીરી સરળ અને ઝડપી બને તેમજ જહેર સેવક તરીકે અમદાવાદ ખુનિસિપલ કોપોરિશનના અધિકારીશ્રી અને કમચારીઓને લાગુ પડતા વર્તાણૂક ( શિસ્ત અને અપીલ ) નિયમો સંબંધમાં તેઓની જવાબદારી અને ફરજ પ્રત્યે વ્યાપક સમજ પ્રવર્તે તે હેતુથી આ પુસ્તિકા પ્રકાશન કરવામાં આવેછે.

વિજ્ઞલન્સ ખાતાની કામગીરી અંગેની સંપૂર્ણ વિગતો આ પુસ્તીકામાં આપવામાં આવેલ છે. તેમ છતાં વિજ્ઞલન્સ ખાતાની કામગીરી અંગે વધુ માહિતી આવશ્યક હોયતો નીચે જણાવેલ અધિકારીશ્રીઓનો સંપર્ક કરવો.

1. શ્રી દિલીપભાઈ વી.પટેલ  
જહેર માહિતી અધિકારી અને આસી.મેનેજર(વિજ્ઞ.જન.૦૨)  
અમદાવાદ ખુનિ.કોપોરિશન,  
સરદાર પટેલ ભવન “સી” બ્લોક, પહેલો માળ,  
દાણાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.  
ટે.નં. ૨૫૩૮૯૮૯૯/૫૪૧,
2. શ્રી વીજાબેન પી.પટેલ  
જહેર માહિતી અધિકારી અને આસી.મેનેજર(વિજ્ઞ.જન.૦૩)  
અમદાવાદ ખુનિ.કોપોરિશન,  
સરદાર પટેલ ભવન “સી” બ્લોક, પહેલો માળ,  
દાણાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.  
ટે.નં. ૨૫૩૮૯૮૯૯/૬૮૪,
3. શ્રી વિપુલભાઈ આર.ગાંધી  
જહેર માહિતી અધિકારી અને આસી.સીટી.એન્જી. (ટેકનીકલ)  
અમદાવાદ ખુનિ.કોપોરિશન,  
સરદાર પટેલ ભવન “સી” બ્લોક, પહેલો માળ,  
દાણાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.  
ટે.નં. ૨૫૩૮૯૮૯૯/૪૨૯

૪. શ્રી ઉમેશભાઈ ભવુ  
જાહેર માહિતી અધિકારી અને આસી.એસ્ટેટ-ટી.ડી.ઓ.  
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન,  
સરદાર પટેલ ભવન “સી” બ્લોક, પહેલો માળ,  
દાણાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.  
ટે.નં. ૨૫૩૮૯૮૯૯/૬૪૧

૫. અપીલ અધિકારી અને તેઘુટી ડાયરેક્ટર (વિજ્ઞલન્સ),  
અમદાવાદ મહાનગર સેવા સંદર્ભ  
સરદાર પટેલ ભવન “સી” બ્લોક, બીજો માળ,  
દાણાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.  
ટે.નં. ૨૫૩૫૦૩૩૮, ૨૫૩૯૮૮/૬૫૮

વધુમાં આ પુસ્તીકામાં ઉપલબ્ધ ન હોય તેવી માહિતી મેળવવા માટે વિજ્ઞલન્સ ખાતાના જાહેર  
માહિતી અધિકારીશ્રીને લેખિત અરજી કરી તે અંગેની રાજ્ય સરકારે મુકરર કરેલી ફી ચુકવી નિયત  
સમય મર્યાદામાં અરજદાર જરૂરી માહિતી પોતાના દરાવિલ સરનામે મેળવી શકેછે. જો આ માહિતી  
સક્ષમ સત્તાને જાહેરહીતમાં આપવી યોગ્ય નહી જણાયતો તે અંગેની અરજદારશ્રીને લેખીતમાં  
જાણ કરવામાં આવશે.

## ૧. વ્યવસ્થાતંત્ર કાર્યો અને ફરજો :-

અમદાવાદ ખુનિ.કોપોરિશનનાં તમામ ખાતાઓની નિયમિતતા બાબતની દેખરેખ, અમદાવાદ ખુનિ. કોપોરિશન ના તમામ વહીવટી તથા ટેકનીકલ ખાતાઓના અધિકારી/કર્મચારીઓ વિરુદ્ધ આવેલ ભષાચાર અને ગેરરીતીઓને લગતી ફરિયાદોની તપાસ કરી યોગ્ય નિકાલ કરવાની, તથા ખુનિ.કોપોરિશનના વિવિધ ખાતાઓના કર્મચારીઓનું હાજરી ચેકીંગ કરી, ખાતાઓને કાર્યક્ષમ રાખવાની કામગીરી ખુનિ. કમિશનરશ્રી ની સીધી દેખરેખ તથા રાહબરી હેઠળ વિજીલન્સ ખાતા દ્વારા કરવામાં આવે છે.

- ખુનિસિપલ અધિકારી / કર્મચારીએ અયોગ્ય હેતુ કે લાંચ, ભષાચાર, ગેરરીતી આચરી કોઈ કામ કે વ્યવહાર કર્યાનો કોઈ આક્ષેપ હોયતો તપાસ કરી શકેછે.
- ખુનિસિપલ અધિકારી / કર્મચારીશ્રીએ અયોગ્ય હેતુ કે, લાંચરુદ્ધત, ભષાચાર, ગેરવર્તર્ણૂક અને ગેરરીતી કરી હોય અથવા તો આવા હેતુસર પોતાની સત્તાનો દુર ઉપયોગ કરેલ હોય, તો તેવી મળેલ ફરિયાદ બાબતે તપાસ કરી શકેછે.
- ખુનિસિપલ કોપોરિશનના ખાતાઓની વહીવટી કાર્યપદ્ધતિ અને પ્રણાલી પ્રથાઓની સમીક્ષા કરી શકેછે.
- વિજીલન્સ ખાતાની કામગીરી (૧) જનરલ તથા (૨) ટેકનીકલ એમ બે વિભાગમાં વહેંચાયેલી છે.

## (અ) જનરલ વિભાગ :-

- અમદાવાદ ખુનિ.કોર્પો.ના રેવન્યુ તથા નોન રેવન્યુ મળી ૪૫ જેટલા જુદા જુદા ખાતાઓ તથા શેઠ વા.સા.જનરલ હોસ્પીટલ, શેઠ લ.ગો. ખુનિસિપલ જનરલ હોસ્પીટલ, શ્રીમતિ શા.ચી.લા.ખુનિસિપલ જનરલ હોસ્પીટલ, શ્રી ચી.હ.નગરી ખુનિસિપલ આંખની હોસ્પીટલ, ટી.બી.હોસ્પીટલ, દવાખાનાઓ, પ્રસુતિગૃહો, રેફરલ હોસ્પીટલો તેમજ એન.એચ.એલ. ખુનિસિપલ મેડીકલ કોલેજ, સ્વર્ણિમ ટેન્ટલ કોલેજ દ્વારા અપાતી સેવાઓ બાબતે શહેરી નાગરીકો, સરકારી -બિન સરકારી સંસ્થાઓ, રાજકીય પદાધિકારીઓ તેમજ ખુનિ.કોર્પો. ના ઉચ્ચ અધિકારીઓ તરફથી આવતી ફરિયાદોનો નિકાલ વિજીલન્સ ખાતાના જનરલ વિભાગ દ્વારા કરવામાં આવે છે.
- વિજીલન્સ ખાતાના જનરલ વિભાગને લગતી પ્રાથમિક તપાસની કામગીરી માટે ૦૧- ડેઝુટી ડાયરેક્ટર, ૦૨ - આસી.મેનેજર, ૦૩- વિજીલન્સ ઓફીસર (જનરલ) અને ૧૪ આસી. વિજીલન્સ ઓફીસર મળી કુલ-૨૦ અધિકારીઓની જગ્યાઓ મંજુર થયેલ છે, જે પૈકી, વિજીલન્સ ઓફીસરની ૦૨ જગ્યા અને આસી.વિજીલન્સ ઓફીસરની ૦૮ જગ્યા મળી કુલ-૧૦ જગ્યાઓ હાલમાં ખાલી છે.

(૧) ડેયુટી ડાયરેક્ટર (વિજીલન્સ) દ્વારા થતી કામગીરીઓ :-

- વિજીલન્સ ખાતાની તમામ વહીવટી કામગીરી
- વર્ગ-૦૧ ના અધિકારીઓને N.O.C.આપવાની કામગીરી.
- વિજીલન્સ ખાતાના જનરલ વિભાગ, એસ્ટેટ/ટી.ડી.ઓ. વિભાગ અને ઈલેક્ટ્રીકલ એન્ડ મીડિનીકલ વિભાગના અધિકારીઓ દ્વારા થતી પ્રાથમિક તપાસની કામગીરીઓનું સુપરવિઝન તથા ટેચરેખ રાખવાની કામગીરી.
- વિજીલન્સ ખાતાના જનરલ વિભાગના આસી.મેનેજરો, વિજીલન્સ ઓફીસરો અને આસી. વિજીલન્સ ઓફીસરોને પ્રાથમિક તપાસને લગતું જરૂરી માર્ગદર્શન આપવાની કામગીરી.
- આ વિભાગોના પ્રાથમિક તપાસ રીપોર્ટ સક્ષમ સત્તા સમક્ષ નિર્ણયાર્થ મુકવાની કામગીરી.

(૨) આસી.મેનેજર (જન.૦૧) દ્વારા થતી કામગીરીઓ :-

- ભૂનિ.કોર્પો.ના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ કોન્ઝરવન્સી સર્વિસીસ વિભાગ, પાર્કસ એન્ડ ગાર્ડન, સેન્ટ્રલ રેકર્ડ તથા ટેન્ડર ઓફીસ, સેન્ટ્રલ વર્કશૉપ, સેન્ટ્રલ સ્ટોર્સ, સેન્ટ્રલ મેડીકલ સ્ટોર્સ, ભૂનિ.હોસ્પિટલો (તમામ) પ્રસૂતિગૃહો / દવાખાના, કુંઠબ કલ્યાણ / આર.સી.એચ. સેવાઓ, ફાયર બ્રીગેડ, સ્નાનાગાર, ભૂજિયમ, કંકરીયા લેક, ઝુ, બાલવાટીકા, એમ.જે.લાયબ્રેરી, સી.એન.સી.ડી., સ્લોટર હાઉસ, જન્મ મરણ, મેલેરીયા, ભૂનિ.મેડીકલ કોલેજો, હેલ્પ, એ.એમ.ટી.એસ; સેન્ટ્રલ ઓફીસ, સેન્ટ્રલ લેબોરેટરી, ઈ-ગર્વનન્સ (સિવીક સેન્ટરો ) અને એકાઉન્ટ ખાતા વિરુધ આવતી ફરીયાદોની પ્રાથમિક તપાસ કરવાની તથા રીપોર્ટ તૈયાર કરવાની કામગીરી.
- ઈલેક્ટ્રીકલ એન્ડ મીડિનીકલ, પાવર પ્લાન્ટ, વોટર ઓપરેશન જેવા ખાતાઓમાં ફરજ બજાવતા નોન ટેકનીકલ કર્મચારીઓ વિરુધ આવતી ફરીયાદોની પ્રાથમિક તપાસ કરવાની તથા રીપોર્ટ તૈયાર કરવાની કામગીરી.

(૩) આસી.મેનેજર (જન.૦૨) દ્વારા થતી કામગીરીઓ :-

- ભૂનિ.કોર્પો.ના જુદા જુદા ખાતાઓમાં ફરજ બજાવતા વર્ગ-૨ ના અધિકારીઓ તથા વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓની બઢતી અને નિવૃત્તિ વખતે તથા પાસપોર્ટ કઢાવવા માટે વિજીલન્સ ખાતાની એન.ઓ.સી.આપવા અંગેની કામગીરી.
- ભૂનિ.કોર્પો.ના વીકલ ટેક્ષ, યુ.સી.ડી, મધ્યાહન ભોજન યોજના, ઈલેક્શન, બાલભવન, પુસ્તકાલય, વ્યાયામ વિધાલય, પ.વ.એકાઉન્ટ, પ્રોપર્ટી ટેક્ષ, ઈ.શી; આઈ.આર; લીગલ, પણ્ણીસીટી, સ્કૂલબોર્ડ, માધ્યમિક શાળાઓ, પ્રોફેશનલ ટેક્ષ, ગુમાસ્તાધારા, ઓડીટ, સેકેટરી અને પ્લાનીગ ખાતા વિરુધની ફરીયાદોની પ્રાથમિક તપાસ કરવાની તથા રીપોર્ટ તૈયાર કરવાની કામગીરી.
- એસ.ટી.પી. અને એસ્ટેટ-ટી.ડી.ઓ. ખાતામાં ફરજ બજાવતા નોન ટેકનીકલ કર્મચારીઓ વિરુધ આવતી ફરીયાદોની પ્રાથમિક તપાસ કરવાની તથા રીપોર્ટ તૈયાર કરવાની કામગીરી.

(બ) ટેકનીકલ વિભાગ :-

વિજ્ઞલન્સ ખાતાના ટેકનીકલ વિભાગની કામગીરી ત્રણ પેટા વિભાગમાં વહેચાયેલ છે.  
(૧) એન્જિનીયરીગ વિભાગ (૨) એસ્ટેટ-ટી.ડી.ઓ. વિભાગ (૩) ઇલેક્ટ્રીકલ એન્ડ મીકેનીકલ વિભાગ.

૧. એન્જિનીયરીગ વિભાગ :-

- ખુનિ.કોપોરેશનના ૦૬ જોન દ્વારા થતી ટેકનીકલ કામગીરી તથા જુદા જુદા પ્રોજેક્ટોની ટેકનીકલ કામગીરીની દેખરેખ રાખવા તેમજ આ કામગીરી સંદર્ભે આવતી ફરીયાદોની પ્રાથમિક તપાસ કરવા વિજ્ઞલન્સ ખાતામાં ૦૧ ડેઝ્યુટી સીટી એન્જિનીયર તથા આસી.સી.ટી.એન્જ. (ટેકનીકલ) ની નિમણૂંક કરવામાં આવેલ છે. આ વિભાગના પ્રાથમિક તપાસના રીપોર્ટ ડેઝ્યુટી સીટી એન્જિનીયર મારફતે સક્ષમ સત્તા સમક્ષ નિષયાર્થે મૂકવામાં આવે છે.

૨. એસ્ટેટ/ ટી.ડી.ઓ.વિભાગ :-

- ખુનિ.કોપોરેશનના ૦૬ જોનના એસ્ટેટ / ટી.ડી.ઓ. ખાતાઓ દ્વારા થતી કામગીરીઓની દેખરેખ રાખવા, ખુનિ.કોપોરેશનની હદમાં થતા ગેરકાયદે બાંધકામો / દબાણો દૂર કરાવવા તથા દરેક જોનના એસ્ટેટ/ટી.ડી.ઓ. ખાતાના ટેકનીકલ કર્મચારીઓ વિરુદ્ધ આવતી ફરીયાદોની પ્રાથમિક તપાસ કરવા વિજ્ઞલન્સ ખાતામાં આસી.એસ્ટેટ/ટી.ડી.ઓ. ની નિમણૂંક કરવામાં આવેલ છે. આ વિભાગના પ્રાથમિક તપાસના રીપોર્ટ મેનેજર / ડેઝ્યુટી એચ.ઓ.ડી.મારફતે સક્ષમ સત્તા સમક્ષ નિષયાર્થે મૂકવામાં આવે છે.

૩. ઇલેક્ટ્રીકલ એન્ડ મીકેનીકલ વિભાગ :-

- આ વિભાગના વિજ્ઞલન્સ ઓફિસર (ઇ એન્ડ એમ)ની જગ્યા હાલમાં ખાલી છે.
- આ વિભાગમાં ફરજ બજાવતા નોન ટેકનીકલ કર્મચારીઓ વિરુદ્ધ આવતી ફરીયાદોની પ્રાથમિક તપાસની કામગીરી આસી.મેનેજર (જન.૦૨) દ્વારા કરવામાં આવે છે તથા પ્રાથમિક તપાસના રીપોર્ટ મેનેજર / ડેઝ્યુટી એચ.ઓ.ડી.મારફતે સક્ષમ સત્તા સમક્ષ નિષયાર્થે મૂકવામાં આવે છે.

## **૨ અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો:-**

### **૧. ડેયુટી ડાયરેક્ટર (વિજીલન્સ) :-**

- ભૂનિ.કમિશનરશ્રી,ડે.ભૂનિ.કમિશનર(વિજીલન્સ)તેમજ દરેક ઝોનના ડે.ભૂનિ.કમિશનરશ્રી તરફથી સોપવામાં આવતી ફરીયાદોની પ્રાથમિક તપાસ કરવાની તેમજ નાગરીકો તરફથી આવતી ફરીયાદોનો તાકીદ નિકાલ કરવાની કામગીરી મેનેજરશ્રી દ્વારા કરવામાં આવે છે.
- વિજીલન્સ ખાતાની તમામ વહીવટી કામગીરી
- વર્ગ-૦૧ ના અધિકારીઓને N.O.C.આપવાની કામગીરી.
- વિજીલન્સ ખાતાના જનરલ વિભાગ, એસ્ટેટ/ટી.ડી.ઓ. વિભાગ અને ઈલેક્ટ્રીકલ એન્ડ મીડિનીકલ વિભાગના અધિકારીઓ દ્વારા થતી પ્રાથમિક તપાસની કામગીરીઓનું સુપરવિઝન તથા દેખરેખ રાખવાની કામગીરી.
- વિજીલન્સ ખાતાના જનરલ વિભાગના આસી.મેનેજરો, વિજીલન્સ ઓફિસરો અને આસી.વિજીલન્સ ઓફિસરોને પ્રાથમિક તપાસને લગતું જરૂરી માર્ગદર્શન આપવાની કામગીરી.
- આ વિભાગોના પ્રાથમિક તપાસ રીપોર્ટ સક્ષમ સત્તા સમક્ષ નિર્ણયાર્થે મૂકવાની કામગીરી.

### **૨. ડેયુટી સીટી એન્જનીયર (વિજીલન્સ) :-**

- ભૂનિ.કોપેરિશનના ૦૬ ઝોન દ્વારા થતી ટેકનીકલ કામગીરી તથા જુદા જુદા પ્રોજેક્ટોની ટેકનીકલ કામગીરીની દેખરેખ રાખવા તેમજ આ કામગીરી સંદર્ભે આવતી ફરીયાદોની પ્રાથમિક તપાસ કરવા વિજીલન્સ ખાતામાં ૦૧ ડેયુટી સીટી એન્જનીયર તથા ૦૨ આસી.સીટી.એન્જી (ટેકનીકલ) ની નિમણૂંક કરવામાં આવેલ છે. આ વિભાગના પ્રાથમિક તપાસના રીપોર્ટ ડેયુટી સીટી એન્જનીયર મારફતે સક્ષમ સત્તા સમક્ષ નિર્ણયાર્થે મૂકવામાં આવે છે.

### **૩. આસી.મેનેજર :-**

- આસી.મેનેજરશ્રી દ્વારા તેઓને સોપવામાં આવેલ ખાતાઓની બ્રાચાર, ગેરરીતી, તેમજ બેદરકારીની આવતી ફરીયાદોનો યોગ્ય તપાસ કરી નિકાલ કરવાની કામગીરી કરવામાં આવે છે. તેમજ ડેયુટી ભૂનિસિપલ કમિશનરશ્રી (વિજીલન્સ)ની સુચના મળ્યેથી જુદા જુદા ખાતાઓના સ્ટાફની હાજરી ચેકીગની કામગીરી કરવામાં આવે છે.
- આસી.મેનેજરશ્રી દ્વારા તેઓના તાબા હેઠળ કામ કરતા તમામ સ્ટાફનું સંચાલન તથા માર્ગદર્શન ની કામગીરી કરવામાં આવે છે. ઉપરાંત તેમને સોપવામાં આવેલ ખાતાઓ અંગે આવતી આર.ટી.આઈ.અરજીઓનો જરૂરી માહીતી આપી નિકાલ કરવામાં આવે છે.
- તદુપરાંત વખતો વખત ભૂનિ.કમિશનરશ્રી તથા ડે.ભૂનિ.કમિશનરશ્રીઓ તરફથી સોપવામાં આવતી કામગીરી કરવામાં આવે છે.

#### ૪. આસી.સીટી.એન્જી. (ટેક):-

- ખુનિ.કોપોરિશનની ટેકનીકલ કામગીરી સાથે સંકળાયેલ ખાતાઓની તપાસ ટેકનીકલ વિભાગ દ્વારા કરવામાં આવે છે.
- ઈજનેર ખાતાની કામગીરી માટે ખુનિ.કોપોરિશનનાં છ જોન તથા પ્રોજેક્ટ માટે ૦૨ આસી.સીટી.એન્જી.શ્રી (ટેક) ની નિમણુંક કરવામાં આવેલ છે. તેઓશ્રી દ્વારા ખુનિ.કોપોરિશન દ્વારા હાથ ધરવામાં આવતા પ્રોજેક્ટ, બીલ્ડીંગ, રોડ-રસ્તા, પાણી અને ગટરને લગતા નાગરીક સુવિધાના કામોનું ચેકીગ તથા આવેલ ફરીયાદોના નિકાલની કામગીરી કરવામાં આવે છે. ઈજનેર ખાતાના તમામ સ્ટાફનું હાજરી ચેકીગ કરવાની કામગીરી.
- રોડ પ્રોજેક્ટ, બ્રીજ પ્રોજેક્ટ, ડ્રેનેજ પ્રોજેક્ટ, વોટર પ્રોજેક્ટ, હાઉસીંગ હોટ મીલ્સ પ્લાન્ટ, એન.આર.સી.પી. એસ.એન.પી. વગેરે કામના મોનીટરીંગ તથા કવોલીટી ચેકીગ તેમજ દરેક ઝોનમાં ટેન્ડરથી કરાવાતા કામોનું ગુણવત્તાનું ચેકીગ કરી તે અંગેના રિપોર્ટ સક્ષમ સત્તા સમક્ષ મુકવાની કામગીરી.

#### ૫. આસી.એસ્ટેટ-ટી.ડી.ઓ.:-

- એસ્ટેટ/ટી.ડી.ઓ. ખાતાની કામગીરી માટે આસી. એસ્ટેટ-ટી.ડી.ઓ. ઈન્સ્પેક્ટર (એસ્ટેટ-ટી.ડી.ઓ.) સબ ઈન્સ્પેક્ટર(એસ્ટેટ-ટી.ડી.ઓ.) નિમણુંક કરવામાં આવેલ છે, જેઓ ખુનિ. કોપોરિશનની હદમાં થતાં ગેરકાયદેસર બાંધકામ તથા દબાણોને લગતી આવેલ ફરીયાદોનો નિકાલ કરવાની કામગીરી કરે છે. એસ્ટેટ-ટી.ડી.ઓ. ખાતાના તમામ સ્ટાફનું હાજરી ચેકીગ કરવાની કામગીરી.

#### ૬. વિજિલન્સ ઓફિસર (લાઈટ (ઇએન્ડએમ)):- (હાલમાં જગ્ગા ખાલી)

#### ૭. વિજિલન્સ ઓફિસર (જનરલ):-

- સક્ષમ સત્તા દ્વારા વિજિલન્સ ખાતે મોકલવામાં આવતી ફરીયાદો બાબતે આસી. મેનેજરશ્રીની સીધી દેખરેખ હેઠળ સ્થળ તપાસ કરી ચેકીગ કરી સાચી હકીકતોનો સક્ષમ સત્તાને રીપોર્ટ કરવો.
- ખુનિસિપલ કોપોરિશનના વહીવટી ખાતાઓનાં અધિકારી / કર્મચારીઓ વિરુદ્ધ આવેલ ફરીયાદોની પ્રાથમીક તપાસ કરી તેનો હકીકતલક્ષી રિપોર્ટ આસી. મેનેજરશ્રી દ્વારા સક્ષમ સત્તાને કરવો.
- ઉપરાંત ઉપરી અધિકારીશ્રીઓ તરફથી વખતો વખતો વખત સોંપવામાં આવે તે કામગીરી વિજિલન્સ - ઓફિસર (જનરલ) દ્વારા કરવામાં આવે છે.

#### ૮. આસી.વિજિલન્સ ઓફિસર (જનરલ) :-

- તમામ ઝોનનાં વહીવટી ખાતાઓના અધિકારી / કર્મચારીઓ સામે થયેલ ભણ્ણાચાર અને ગેરરીતીઓને લગતી થયેલ ફરીયાદોની તપાસ કરી નિકાલ કરવો તથા સ્ટાફનું હાજરી ચેકીગ કરવું.
- ખુનિ. જનરલ હોસ્પિટલો તથા કોપોરિશન સંચાલિત તમામ દવાખાનાઓને લગતી ફરીયાદોમાં પ્રાથમીક તપાસ કરી સક્ષમ સત્તાને રીપોર્ટ કરવો.

- તદુપરાંત વખતો વખત ઉપરી અધિકારીશ્રી તરફથી સોંપવામાં આવતી કામગીરી કરવામાં આવે છે.

#### ૮. ઈન્સ્પેક્ટર (એસ્ટેટ-ટી.ડી.ઓ.) :-

- આસી.એસ્ટેટ-ટી.ડી.ઓ.શ્રીના મદદનીશ તરીકે તથા એસ્ટેટ-ટી.ડી.ઓ.ખાતેથી ગેરકાયદેસર બાંધકામ, દબાણ અને અધિકારી / કર્મચારી વિરુદ્ધમાં આવતી તમામ ફરીયાદની તપાસ કરી રીપોર્ટ તૈયાર કરવો.
- તદુપરાંત વખતો વખત ઉપરી અધિકારીશ્રી તરફથી સોંપવામાં આવતી કામગીરી કરવામાં આવે છે

#### ૧૦ ટેકનીકલ સુપરવાઈઝર:-

- આસી.સી.ટી.એન્જી.(ટેક)શ્રીના મદદનીશ તરીકેની તથા તેઓશ્રી તરફથી વખતો વખત સોંપવામાં આવતી કામગીરી અંગેનો સક્ષમ સત્તાને રીપોર્ટ કરવો.
- તદુપરાંત વખતો વખત ઉપરી અધિકારીશ્રી તરફથી સોંપવામાં આવતી કામગીરી કરવામાં આવે છે.

#### ૧૧ સબ-ઇન્સ્પેક્ટર :- (એસ્ટેટ-ટી.ડી.ઓ.) :-

- આસી.એસ્ટેટ-ટી.ડી.ઓ.અને ઈન્સ્પેક્ટર (એસ્ટેટ-ટી.ડી.ઓ.) ના મદદનીશ તરીકે તથા તેઓશ્રી તરફથી વખતો વખત સોંપવામાં આવતી કામગીરી કરવી.
- વિજિલન્સ વિભાગ (એસ્ટેટ-ટી.ડી.ઓ.) માં આવતી અરજીઓ ની નોંધણી કરવી, તપાસ રજીસ્ટર મેઇન્ટેઇન કરવું, ફાઇલોની જાળવણી અને નોંધણી મેઇન્ટેઇન કરવી.

#### ૧૨. સેનેટરી સબ-ઇન્સ્પેક્ટર :- :-(હાલમાં જગ્ગા ખાલી)

- તમામ હેલ્પ મસ્ટર સ્ટેશનોનું હાજરી ચેકિંગ તથા ઉપરી અધિકારીશ્રી તરફથી હેલ્પ ખાતાને લગતી વખતો વખત સોંપવામાં આવતી ફરીયાદોની તપાસ કરી સક્ષમ સત્તાને રીપોર્ટ કરવો.

#### ૧૩. ટાઈપીસ્ટ-કમ-કલાર્ક:- (હાલમાં જગ્ગા ખાલી)

- આસી.મેનેજરશ્રીઓ તથા તમામ વિજિલન્સ ઓફિસરશ્રીઓ તરફથી તૈયાર કરવામાં આવતાં રિપોર્ટ્સ, પત્ર વ્યવહાર, ટાઈપ કરવાની કામગીરી તેમજ તે બાબતે રિપોર્ટ્સની ગુપ્તતા જાળવવી.
- તદુપરાંત વખતો વખત ઉપરી અધિકારીશ્રી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરી કરવામાં આવે છે.

#### ૧૪. સ્ટેનો :-

- આસી.મેનેજરશ્રીઓ તથા તમામ વિજિલન્સ ઓફિસરશ્રીઓ તરફથી તૈયાર કરવામાં આવતાં રિપોર્ટ્સ, પત્ર વ્યવહાર, ટાઈપ કરવાની કામગીરી તેમજ તે બાબતે રિપોર્ટ્સની ગુપ્તતા જાળવવી.

- તદઉપરાંત વખતો વખત ઉપરી અધિકારીશ્રી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરી કરવામાં આવે છે.

#### **૧૫. સીનીથર કલાકું:-**

- ખાતાને લગતી વહીવટી, નાણાંકીય ,તેમજ કન્ટીજન્સી વગેરેને લગતી બાબતોની કામગીરી ઉપરાંત વખતો વખત ઉપરી અધિકારીશ્રી તરફથી સોંપવામાં આવતી કામગીરી કરવામાં આવે છે.

#### **૧૬. જુનીથર કલાકું:-**

- ખાતાને લગતી વહીવટી, નાણાંકીય ,તેમજ કન્ટીજન્સી તથા આર.ટી.આઈ.વિગેરેને લગતી બાબતોની કામગીરી ઉપરાંત વખતો વખત ઉપરી અધિકારીશ્રી તરફથી સોંપવામાં આવતી કામગીરી કરવામાં આવે છે.

#### **૧૭. સર્વેબોધ / પટાવાળા:-**

- ખાતાની ટપાલ અન્ય ખાતે પહોંચાડવાની કામગીરી ઉપરાંત ખાતાના અધિકારી/કર્મચારી તરફથી સોંપવામાં આવતી કામગીરી કરવામાં આવે છે.

**૩ દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહીત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતી :-**

- વિજ્ઞલન્સ ખાતા દ્વારા અમદાવાદ મ્યુનિ.કોપોરિશન હસ્તકના તમામ ખાતાઓમાં વહીવટી કામગીરી ઉપર સતત ચેકીગ તથા હાજરી ચેકીગ અંગેની દેખરેખ રાખવામાં આવે છે. તેમજ કોઈપણ ખાતાના જવાબદાર અધિકારી / કર્મચારી વિરુદ્ધ આવેલ ફરીયાદમાં તપાસ કરી તથા જરૂર જણાયે સ્થળ તપાસ અંગેના રીપોર્ટો મેળવી વિજ્ઞલન્સ તપાસ અંગેનો સમગ્ર અહેવાલ તૈયાર કરવામાં આવે છે અને તે અહેવાલ તે.મ્યુનિ.કમિશનર સાહેબ (વિજ્ઞલન્સ) તરફ યોગ્ય હુકમ અર્થે મોકલવામાં આવે છે. સમગ્ર તપાસ અંગેનો નિર્ણય તે.મ્યુનિ.કમિશનર સાહેબ (વિજ્ઞલન્સ) દ્વારા લેવામાં આવે છે અને મે.મ્યુનિ.કમિશનર સાહેબની મંજુરી મેળવી અને જો અધિકારી / કર્મચારી જવાબદાર જણાયતો તેની શિક્ષા અંગે યોગ્ય હુકમ મેળવવામાં આવે છે. અને ત્યાર બાદ આગળની કાર્યવાહી અર્થે રીપોર્ટ સાથે ફાઈલ અમદાવાદ મ્યુનિ.કોપોરિશનના ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવે છે.

**૪. વિજ્ઞલન્સ ખાતાના કાર્યો બજાવવા માટે નક્કી કરેલા ધોરણો :-**

- વિજ્ઞલન્સ ખાતા દ્વારા કાર્યો બજાવવા અંગે અમદાવાદ મ્યુનિ.કોપોરિશનના વહીવટની ગેરરીતીઓ અંગે, લાંચ રૂશ્શત અંગે, મ્યુનિ.કોપોરિશનના રૂલ્સ, બાયલોઝ કે નિતિ નિયમો વિરુદ્ધ થયેલ કોઈ ગેર કાયદેસર કામગીરી બાબત, જાહેર જનતાની આવતી ફરીયાદો, વિગેરે બાબતો અંગે તપાસ કરવાની હોય છે. જ્યાં આ પ્રકારની ગેરરીતીઓ કે અનિયમિતતા થયેલી અગર થતી માલુમ પડે ત્યાં તપાસ આદરી, ખાતાકીય પગલાં લેવા તજવીજ કરવામાં આવે છે.

તદ્વારાંત વિજ્ઞલન્સ ખાતા દ્વારા ઈજનેર તથા ટી.ડી.ઓ. ખાતાને લગતી તેમજ ટેકનીકલ પ્રકારની ફરીયાદોની તપાસ આ વિભાગના વિજ્ઞલન્સ ઓફિસર (ટેકનીકલ) દ્વારા કરવામાં આવે છે. ઈજનેર ખાતાના કર્મચારીઓનું હાજરી ચેકીગ તેમજ સ્ટોર, સબસ્ટોર, હોટમીક્ષ પ્લાન્ટનું ચેકીગ તથા ગેરકાયદેસર પાણી તેમજ ગાટર કનેક્શનના કેસ બાબતે અને ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ પગલાં લેવાતા ન હોય અથવા વિલંબ કરવામાં આવતો હોય તો તેની ફરીયાદો અંગેની તપાસ કરી તે બાબતે રીપોર્ટ સક્ષમ સત્તા સમક્ષ મુકવામાં આવે છે અને સક્ષમ સત્તાનો હુકમ મેળવી જવાબદાર અધિકારી / કર્મચારી વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવા અંગે કાર્યવાહી કરવામાં આવે છે.

**૫. પોતાના કાર્યો બજાવવા માટે પોતાની પાસેના અથવા પોતાના નિયંત્રણ હેઠળના અથવા પોતાના કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા નિયમો, વિનિયમો, સુચનાઓ, નિયમ સંગ્રહો અને રેકર્ડ.**

- મ્યુનિસિપલ કોપોરિશનના નિતી નિયમો તથા ધી બોમ્બે પ્રોવીન્સીયલ મ્યુ.કોર્પો.એક્ટ-૧૯૪૮ ની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવામાં આવે છે.

**૬. પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક :-**

- અમદાવાદ મ્યુનિસિપલ કોપોરિશન દ્વારા વખતો વખત અમલમાં આવતા નીતિ નિયમ અનુસાર દસ્તાવેજો જાળવવામાં આવે છે.

૭. તેની નિતિ અથવા તેના અમલીકરણના ઘડતરના સબંધમાં જનતાના સભ્યો સાથે વિચાર વિનિમય માટે અથવા તેમના નામ દ્વારા ૨જુઆત માટેની વિધમાન કોઈ ગોઠવણી વિગતો :-

- આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.
- ૮. તેના ભાગ તરીકે અથવા તેની સલાહના હેતુ માટે બે અથવા તેથી વધુ વ્યક્તિત્વોના બનેલા બોર્ડ, કાઉન્સિલો, સમિતિઓ અને બીજા મંડળોની બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ ? અથવા તેવી બેઠકોની કાર્ય નોંધ લોકોને મળવા પાત્ર છે કે કેમ ?
- આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.
- ૯. વિજ્ઞલન્સ ખાતા ના અધિકારીઓ અને કર્મચારીઓની માહીતી પુસ્તીકા

અ.નં.	હોદ્દો	શીડયુલ મુજબ મંજુર થયેલ જગ્યાઓ	ભરાયેલ જગ્યાઓ	ખાલી જગ્યાઓ
૧.	ડાયરેક્ટર ઓફ વિજ્ઞલન્સ	૧	૦	૧
૨.	ઉઘુટી ડાયરેક્ટર (વિજ્ઞલન્સ)	૧	૧	૦
૩.	ઉઘુટી સીટી એન્જનીયર.	૧	૧	૦
૪.	આસી.સી.ટી.એન્જનીયર.	૫	૨	૩
૫.	આસી.સી.ટી.એન્જ. (ઈ એન્ડ એમ.)	૧	૦	૧
૬.	આસી.ટી.ડી.ઓ.	૧	૧	૦
૭.	આસી.મેનેજર	૨	૨	૦
૮.	વિજ્ઞલન્સ ઓફિસર (જનરલ)	૩	૧	૨
૯.	આસી.વિજ્ઞલન્સ ઓફિસર (જનરલ)	૧૪	૬	૮
૧૦.	એસ્ટેટ-ટી.ડી.ઓ.ઇન્સ્પેક્ટર	૧	૧	૦
૧૧.	એસ્ટેટ-ટી.ડી.ઓ.સબ ઇન્સ્પેક્ટર	૧	૧	૦
૧૨.	એસ્ટેટ-ટી.ડી.ઓ. ટેકનીકલ ઇન્સ્પેક્ટર	૩	૩	૦
૧૩.	ટેકનીકલ સુપરવાઈઝર (સિવીલ)	૫	૩	૨
૧૪.	ટેકનીકલ સુપરવાઈઝર (ઇલે.)	૧	૦	૧
૧૫.	સ્ટેનોગ્રાફર	૧	૦	૧
૧૬.	ટાઈપીસ્ટ	૧	૦	૧
૧૭.	સીની.કલાર્ક	૩	૨	૧
૧૮.	જુની.કલાર્ક	૪	૪	૦
૧૯.	પટાવાળા	૪	૪	૦
કુલ :-		૫૩	૩૨	૨૧

**૧૦. તેના વિનિયમોમાં જોગવાઈ કર્યા પ્રમાણે વળતરની પધતિ સહીત તેના દરેક અધિકારીઓ અને કર્મચારીઓને મળતા માસિક વળતર.:-**

અનુંન.	હોદ્દો	પે-બેન્ડ	ગ્રેડ પે
૧.	ટેલ્યુટી ડાયરેક્ટર (વિજ્ઞલન્સ)	૧૫૬૦૦ - ૩૮૧૦૦	૬૬૦૦
૨.	ટેલ્યુટી સીટી એન્જી.	૧૫૬૦૦ - ૩૮૧૦૦	૬૬૦૦
૩.	આસી.મેનેજર	૮૩૦૦-૩૪૮૦૦	૫૪૦૦
૪.	આસી.સીટી.ઇજનેર	૮૩૦૦-૩૪૮૦૦	૫૪૦૦
૫.	આસી.ટી.ડી.ઓ.	૮૩૦૦-૩૪૮૦૦	૫૪૦૦
૬.	વી.ઓ.	૮૩૦૦-૩૪૮૦૦	૪૬૦૦
૭.	ઇન્સ્પેક્ટર	૮૩૦૦-૩૪૮૦૦	૪૬૦૦
૮.	સબ ઇન્સ્પેક્ટર	૮૩૦૦-૩૪૮૦૦	૪૪૦૦
૯.	આસી.વિજ.ઓફીસર	૮૩૦૦-૩૪૮૦૦	૪૨૦૦
૧૦.	સીની.કલાર્ક	૫૨૦૦-૨૦૨૦૦	૨૪૦૦
૧૧.	જુની.કલાર્ક	૫૨૦૦-૨૦૨૦૦	૧૬૦૦
૧૨.	સ્ટેનો	ફીક્સ પગાર	૬૦૦૦/-
૧૩.	સધાયક સબ ઇન્સ્પેક્ટર	ફીક્સ પગાર	૬૦૦૦/-
૧૪.	પટાવાળા	૪૪૪૦-૭૪૪૦	૧૬૫૦

**૧૧. તમામ યોજનાઓ, સુચિત ખર્ચ અને કરેલ વહેચણી પરના અહેવાલોની વિગતો દર્શાવતું તેની દરેક એજન્સીઓ ફાળવેલ અંદાજ પત્ર.**

વિજ્ઞલન્સ ડિપાર્ટમેન્ટ-કોમ્પ્યુટર કોડ-૧૨૦

સને. ૨૦૧૫-૧૬ (અંદાજીત) ના બજેટમાં વિજ્ઞલન્સ ડિપાર્ટમેન્ટની અંદાજેલ ખર્ચ.

અ.નં.	વિગત	અંદાજેલ ખર્ચ (રૂ.લાખમાં)
૧.	પગાર ખર્ચ	૧૩૭.૪૪
૨.	ટેલીફોન તથા ટ્રેક્કોલ (ઓફીસ)	૨.૨૫
૩.	પોસ્ટેજ તથા ટેલીગ્રામ	૦.૨૫
૪.	ઇન્સ્પેક્શન-સેમ્પલ ટેસ્ટીંગ ચાર્જ	૦.૨૦
૫.	સ્ટેશનરી	૦.૬૦
૬.	પ્રિન્ટીંગ	૦.૧૪
૭.	અન્ય ખર્ચ	૧.૦૦
૮.	યુનિફોર્મ	૦.૧૪
કુલ :-		૧૪૨.૦૪

૧૨. ફાળવેલ રકમો, અને એવા કાર્યક્રમોના લાભાર્થીઓની વિગતો સહીત આર્થિક સહાય કાર્યક્રમોની અમલ બજારણી રીત.
- આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.
૧૩. તેણે આપેલ છૂટ છાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારની વિગતો.
- આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.
૧૪. ઈલેક્ટ્રોનીક સ્વરૂપમાં તેને ઉપલબ્ધ અથવા તેણે ધરાવેલ માહીતીને લગતી વિગતો.
- અતેના વિભાગની ફાઈલોમાં જેમાં ઈલેક્ટ્રોનીક સ્વરૂપમાં માહીતી ઉપલબ્ધ હોય તે જે તે સ્વરૂપમાં નિયત નિયમાનુસાર ફી ભરી મેળવી શકાય.
૧૫. જીહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતા હોય તો તેવા ગ્રંથાલય અથવા તેના વાંચનાલયના કામકાજના કલાકો સહીતની માહીતી મેળવવા માટે નાગરીકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો.
- આ વિભાગમાં કોઈ ગ્રંથાલય નથી.

૧૬. જાહેર માહિતી અધિકારીઓના નામો, હોદ્દાઓ અને બીજી વિગતો.

૧. શ્રી દિલીપભાઈ વી.પટેલ  
જાહેર માહિતી અધિકારી અને આસી.મેનેજર(વિજ.જન.૦૨)  
અમદાવાદ ખુનિ.કોર્પોરેશન,  
સરદાર પટેલ ભવન “સી” બ્લોક, પહેલો માળ,  
દાણાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.  
ટે.નં. ૨૫૩૮૯૮૯૯/૫૪૧,
૨. શ્રી વીણાબેન પી.પટેલ  
જાહેર માહિતી અધિકારી અને આસી.મેનેજર(વિજ.જન.૦૩)  
અમદાવાદ ખુનિ.કોર્પોરેશન,  
સરદાર પટેલ ભવન “સી” બ્લોક, પહેલો માળ,  
દાણાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.  
ટે.નં. ૨૫૩૮૯૮૯૯/૬૮૪,
૩. શ્રી વિપુલભાઈ આર.ગાંધી  
જાહેર માહિતી અધિકારી અને આસી.સીટી.એન્જી.(ટેકનીકલ)  
અમદાવાદ ખુનિ.કોર્પોરેશન,  
સરદાર પટેલ ભવન “સી” બ્લોક, પહેલો માળ,  
દાણાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.  
ટે.નં. ૨૫૩૮૯૮૯૯/૪૨૮
૪. શ્રી ઉમેશભાઈ ભંડુ  
જાહેર માહિતી અધિકારી અને આસી.એસ્ટેટ-ટી.ડી.ઓ.  
અમદાવાદ ખુનિ.કોર્પોરેશન,  
સરદાર પટેલ ભવન “સી” બ્લોક, પહેલો માળ,  
દાણાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.  
ટે.નં. ૨૫૩૮૯૮૯૯/૬૪૧

પ્રકરણ-૫ અપીલ અધિકારીશ્રીનું નામ તથા હોદ્દો :-

મા.શ્રી પ્રીથા સુનિલ,  
અપીલ અધિકારી અને ટેચ્યુટી ડાયરેક્ટર (વિજીલન્સ),  
સરદાર પટેલ ભવન “સી” બ્લોક, બીજો માળ,  
દાણાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.  
ટે.નં. ૨૫૩૫૦૩૩૮, ૨૫૩૮૧૮૧૧ / ૬૫૮

**૧૭. ઠરાવવામાં આવે તેવી બીજી માહીતી :-**

- આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.